

ત્વરિત જાહેરાત માટે

## ગન (બંદૂક) અને ગૅંગ (ગુનેગારોની ટોળકી) હિંસા સામે પગલાં લેતી પહેલની સમવાયી અને પ્રાંતીય જાહેરાતને બ્રેમ્પટન ટેકો આપે છે

બ્રેમ્પટન, ઓન્ટારિયો (26 ઓગસ્ટ 2019) - સીટી ઓફ બ્રેમ્પટન દ્વારા આજે ઓન્ટારિયો ખાતે ગન (બંદૂક) અને ગૅંગ (ગુનેગારોની ટોળકી) હિંસા સામે પગલાં લેતી પહેલની સમવાયી અને પ્રાંતીય સંયુક્ત જાહેરાતને આવકારવામાં આવી.

બ્રેમ્પટનવાસીઓ માટે એક નોંધપાત્ર સાર્વજનિક સુરક્ષા વિશે ચિંતા ઉપજાવતા મુદ્દા તરીકે શહેર એક પ્રાદેશિક અભિગમની અગત્યતાનો સ્વીકાર કરે છે, જ્યારે વાત ગન અને ગૅંગ હિંસાની હોય જે બ્રેમ્પટનને એક સુરક્ષિત શહેર બનાવવાની ખાતરી આપવાની પ્રતિબદ્ધતા દાખવતી હોય. કાઉન્સિલે સિટીનાં 2019 અંદાજપત્રમાં કમ્યુનિટી સેફ્ટી પ્રોજેક્ટ્સ (City's 2019 Budget for Community Safety Projects ) માટે \$3,00,000ની જોગવાઈને મંજૂર કરી છે જેમાં આખા શહેર ફરતે નેબરહૂડ વોચ બ્રેમ્પટન (Neighbourhood Watch Brampton)નું વિસ્તરણ કરવા માટેની તાજેતરમાં કરેલ ફાળવણીઓનો સમાવેશ થાય છે.

ઓન્ટારિઓની ગન્સ, ગૅંગ્સ એન્ડ વાયોલન્સ રિડક્શન સ્ટ્રેટેજીમાં ફેડરલ સરકારનાં \$54 મિલિયનનાં નિવેશને સિટીએ આજે આવકાર્યું જે બ્રેમ્પટનને આ સમસ્યાનું નિરાકરણ કરવું ચાલું રાખવામાં મદદરૂપ થશે. પીલ રિજનલ પોલિસ અને પ્રોવિન્સ ઓફ ઓન્ટારિયો સાથે પીલ ખાતે ઈન્ટેન્સિવ ફાયરઆર્મ બેઈલ ટીમ (Intensive Firearm Bail Team)નાં સર્જનમાં સહયોગ આપવા સિટી સજ્જ છે જે ગ્રેટર ટોરોન્ટો એરિયા (GTA)માં ગન સંબંધિત ગુના માટેની કાર્યવાહીઓ અને જામીનની સુનાવણીઓને ટેકો આપશે.

આજનું જાહેર નિવેદન બ્રેમ્પટન સીટી કાઉન્સિલની ગન અને ગૅંગ પ્રવૃત્તિઓની સમસ્યા પ્રતિ સહયોગલક્ષી અને સાકલ્યવાદી અભિગમ ધરાવતી દરખાસ્તને સમર્થન આપે છે અને તે તાજેતરમાં ઓટાવા ખાતે ઓગસ્ટ 18-21, 2019માં યોજાયેલ એસોસિએશન ઓફ ઓન્ટારિઓ મ્યુનિસિપાલિટીઝની કોન્ફરન્સમાં કાઉન્સિલનાં હિમાયતી પ્રયાસોનો ભાગ હતી.

GTA અને ગ્રેટર ગોલ્ડન હોર્સશુ (Greater Golden Horseshoe)માં કમ્યુનિટી સેફ્ટી પ્રોજેક્ટ્સ અને ભાગીદારીઓનાં સમર્થન પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે જ્યારે પ્રોવિન્સ GTA/ગ્રેટર ગોલ્ડન હોર્સશુ (Greater Golden Horseshoe)(GGH) ગન એન્ડ ગૅંગ ફન્ડ (Gun and Gang Fund) પ્રસ્થાપિત કરી રહ્યા છે ત્યારે સિટી પીલ રિજનલ પોલિસ સાથે મળીને સાર્વજનિક સુરક્ષાનાં પ્રોજેક્ટ્સ હાથ ધરવા માટે કાર્ય કરવાની અપેક્ષા રાખે છે. સિટી અપેક્ષા રાખે છે કે અમલીકરણ પ્રક્રિયા વિશે વધુ વિગતો પ્રાપ્ત થશે અને આ નીધિયન માટે અમલીકરણો અનુક્રમે આગળ ધપાવી શકાશે.

### અવતરણો

“આ કાઉન્સિલની ટર્મ ઓફ કાઉન્સિલ પ્રાયોરિટીઝની મુખ્ય અગ્રિમતા સુરક્ષિત શહેર બનાવવાની છે અને અમે લાંબા સમયથી હિમાયત કરી રહ્યા છીએ કે ગન્સ અને ગૅંગ્સની સમસ્યા માત્ર ટોરોન્ટો અને ઓટ્ટાવા સુધી સીમીત નથી. અમે બ્રેમ્પટન માટે ભંડોળનો ન્યાયિક હિસ્સો મેળવવા લડત ચલાવી રહ્યા છીએ અને સમજીએ છીએ કે બિલ બ્લેર (Bill Blair) અને સિલ્વિયા જોન્સ (Sylvia Jones) સાથે થયેલ બેઠકો બાદ બ્રેમ્પટનને આપણા શહેરમાં ગન્સ અને ગૅંગ્સ સામે લડત આપવા માટે આ મહત્ત્વનું ભંડોળ જરૂર પ્રાપ્ત થશે. બ્રેમ્પટનને રહેવા,

કામ કરવા અને આનંદથી જીવવા માટે એક સુરક્ષિત શહેર બનાવી રાખવા માટે જરૂરી સંસાધનો પૂરા પાડવા પર અમે અમારું ધ્યાન કેન્દ્રિત કરતા રહીશું."

-મેયર પેટ્રિક બ્રાઉન (*Mayor Patrick Brown*)

"બ્રેમ્પટનની ગન્સ અને ગેંગ્સની સમસ્યા સામે લડવા સરકારના તમામ સ્તરો સાથે ભાગીદારીઓ, સમય અને નિવેશ આવશ્યક છે. આજનું જાહેર નિવેદન આપણા સમુદાય પર થયેલ ગન્સ અને ગેંગ્સનો નકારાત્મક પ્રભાવ તેમજ આ સમસ્યાને જડમૂળથી ઉખેડવાનો અમારો સંકલ્પ છતો કરે છે. આપણું યુવાધન અને બાળકોને જીવવા એક સુરક્ષિત સમાજ ઊભો થાય તે સુનિશ્ચિત કરવા અમે સમર્પિત છીએ."

-કાઉન્સિલર શેરમેન વિલિયમ્સ (*Charmaine Williams*), કમ્યુનિટી સેક્ટી એડવાયઝરી કમિટીનાં પ્રમુખ

-30-

કેનેડાના સૌથી ઝડપી વિકાસ કરતા શહેરો પૈકી એક તરીકે બ્રેમ્પટનમાં 650,000 લોકો વસે છે અને તમાં 70,000 વ્યાપારો છે. અમે જે કંઈ કરીએ છીએ તેનો હાર્દ છે લોકો. અમને ઊર્જા મળે છે અમારા વિવિધ સમાજોમાંથી, અમે રોકાણ માટે આકર્ષણનું કેન્દ્ર છીએ અને અમે તકનિકી અને પર્યાવરણીય નવિનતા તરફ દોરી જતા પ્રવાસનું નેતૃત્વ કરીએ છીએ. અમારી ભાગીદારી એવા નિરોગી શહેરના વિકાસ માટે છે જે સુરક્ષિત, ટકાઉ અને સફળ હોય. અમારી સાથે [Twitter](#), [Facebook](#), અને [Instagram](#) પર જોડાવ. અહીં વધુ જાણકારી મેળવો [www.brampton.ca](http://www.brampton.ca).

**મિડિયા સંપર્ક:**

મોનિકા ડુગ્ગલ

કોઓર્ડિનેટર, મિડિયા એન્ડ કમ્યુનિટી એંગેજમેન્ટ

વ્યૂહાત્મક સંવાદ

સીટી ઓફ બ્રેમ્પટન

905-874-3426 | [Monika.Duggal@brampton.ca](mailto:Monika.Duggal@brampton.ca)